

માર્ચ 4, 2019

વસંતઋતુના આગમનને સીડ્ડી સેટરડે (પુષ્કળ બીયારણો દેખાડતો શનિવાર) અને ગાર્ડન શો (બગીચાના પ્રદર્શન)થી વધાવો

બ્રામ્પટન, ઓન્ટેરિયો – આ અઠવાડિક રજામાં સીડ્ડી સેટરડે અને ગાર્ડન શો સાથે વસંતઋતુના આગમનને વધાવવા માટે તૈયાર રહો!

આ વાર્ષિક પ્રસંગ શનિવાર, માર્ચ 9 નાં રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી 340, વોડેન સ્ટ્રીટ ઈસ્ટ સ્થિત, સેન્યુરી ગાર્ડન-સ રિક્રિએશન સેન્ટર ઓડિટોરિયમમાં યોજાશે.

20 ઉપરાંત પ્રદર્શકો સાથે, બગીચાકામ સંબંધિત માહિતી મેળવો, બીયારણો વહેંચો, અદલાબદલી કરો અને ખરીદો, બગીચાકામમાં રસ ધરાવનારાઓના સમુદાયો બનાવો, પ્રદર્શનો અને રજૂઆતોમાં ભાગ લો અને સીડ્ડી કૅફે (Seedy Café) ની મુલાકાત લો. એક કિડ્ઝ ઝોનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પ્રવેશ મફત રહેશે અને પ્રથમ 100 મુલાકાતીઓ એક છોડ મફતમાં મેળવશે.

આ પ્રસંગે દિવસભર પાંચ સેમિનાર્સ યોજાશે.

- સવારે 10:10 વાગ્યાથી 10:50 સુધી – જુલિયા ડાઈમાકોસ (Julia Dimakos) સાથે સીડ બેઝિક્સ 101 (બી સંબંધિત મૂળભૂત માહિતી)
- સવારે 11 વાગ્યાથી 11:45 સુધી – હોમસ્ટીડિંગ (ઘરવાડી બનાવવી), માત્ર સેન્ટિમેન્ટલ ફાર્મ (રસિક ખેતર) ધરાવતા સેલફોનવાળા હિપ્પીસ (સ્વચ્છંદીઓ) નહીં
- બપોરે 12 વાગ્યાથી 12:45 સુધી – જેમ્સ ગ્રેહામ (James Graham) સાથે જમીનની ઉપર ઊગતા શાકભાજીનું બાગકામ
- બપોરે 1 વાગ્યાથી 1:45 સુધી – ટોરોન્ટો રીજીયન કન્ઝર્વેટિવ ઓથોરિટી સાથે પક્ષીઓ, પતંગિયાઓ અને અન્ય ઉડતા જીવો માટેનું બાગકામ
- બપોરે 2 વાગ્યાથી 2:45 સુધી - બ્રામ્પટન એનિમલ સર્વિસીસ સાથે બ્રામ્પટનમાં કોયોટીસ (વરુ) અને વાઈડલાઈફ (વન્યજીવન)

સીટી ઓફ બ્રામ્પટન અને બ્રામ્પટન હોર્ટિકલ્ચરલ સોસાયટી દ્વારા પ્રસ્તુત, સીડ્ડી સેટરડે અને ગાર્ડન શોને સીડ્સ ઓફ ડાઈવર્સિટી દ્વારા સહાયતા મળે છે, જે એક કેનેડિયન સ્વૈચ્છિક સંસ્થા છે જે ખાદ્ય પદાર્થોના પાકો અને બગીચાના છોડોની જૈવિક વિવિધતા અને પરંપરાગત જ્ઞાનને ટકાવી રાખવા કટિબદ્ધ છે.

વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/parks.

અવતરણ (ક્વોટ):

“સીટી ઓફ બ્રામ્પટનમાં, આપણાં સમુદાયોને હરિયાળુ રાખવા અને રહેવાસીઓને બાગકામ સંબંધિત સંસાધનો પૂરા પાડવામાં પ્રવૃત્તમય રહેવા અમે કટિબદ્ધ છીએ. તમે તમારા કુટુંબીજનોને લાવો અને આ પ્રસંગે બાગકામ સંબંધિત કેટલીક માહિતી મેળવો, વક્તાઓને સાંભળો અને ઘણાં પ્રદર્શકોની મુલાકાત લો તે માટે હું તમને પ્રોત્સાહિત કરું છું.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જ્યાં તે એક જોડાણ ધરાવતું શહેર અને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca